



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના દ્વારા CGST ચીફ કમિશ્નર શ્રીમતી સીમા અરોરાની રાજકોટ ખાતે રૂબરૂ મુલાકાત લઈ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ તથા ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા તા.૨૬-૨-૨૦૨૧ ના રોજ રાજકોટ ખાતે આવેલ CGST ચીફ કમિશ્નર શ્રીમતી સીમા અરોરાની રૂબરૂ મુલાકાત લઈ નીચે મુજબ વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓના યોગ્ય નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવેલ.

(૧) સમગ્ર **GST** પ્રક્રિયામાં ઘણાં બધા વેચનાર અને લેનાર સંકળાયેલ હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં વચ્ચેના કોઈ તબક્કે કોઈ જાતની ગેરરીતી આચરવામાં આવે તો છેલ્લો વ્યવહાર કરનાર વ્યક્તિએ ભોગ બનવું પડે છે જેને નિયમોનુસાર મળવાપાત્ર ચતલ મેળવેલ હોવા છતાં તેને રીવર્સ કરવાની ફરજ પાડવામાં આવે છે. પ્રક્રિયામાં ઉદ્ભવેલ સદર ક્ષતીના નિવારણ અર્થે ટેક્સ પેયર દ્વારા કેવા સલામતીભર્યા પગલા લેવા જરૂરી છે તે સબબ રજૂઆત કરવામાં આવેલ છે. નકત એક્ટમાં ટેક્સ પેયરની સલામતી માટે યોગ્ય અને ચુસ્ત પ્રાવધાન કરવા જરૂરી છે.

(૨) પરિવહન દરમ્યાન માલ-સામાનની ચકાસણી દરમ્યાન ઈ-વે બીલમાં ખુબ જ નાની અથવા નગણ્ય કે શરતચુકથી એકાદ આંકડામાં ફેરફાર થવાને કારણે પરિવહન કરતા ટ્રકને અટકાયતમાં લેવામાં આવે છે. આવ કિસ્સામાં કોઈ દંડ ન કરવાની સુચના આપવામાં આવેલ હોવા છતા તેને અવગણવામાં આવે છે. આના કારણે નકત અને પેનલ્ટી બન્ને ચુકવવા પડે છે.

(૩) રીફંડના કિસ્સામાં ફોર્મ RFD08 (કારણદર્શક નોટીસ) ઈશ્યું કરવું ફરજિયાત હોવા છતા અનેક કિસ્સાઓમાં આવી કારણદર્શક નોટીસ બજાવ્યા સિવાય સીધો ઓર્ડર (ફોર્મ RFD08) ઈશ્યું કરવામાં આવે છે.

(૪) અનેક રીફંડ અને તેને આનુશાંગિક કિસ્સાઓમાં જરૂરી અપીલ વર્ષ ૨૦૧૮ માં ફાઈલ કરેલ હોવા છતા આજની તારીખે આવી અપીલો સ્ટેટ એપેલેટ ઓથોરીટીઝ પાસે પડતર પડેલ છે. વળતર અને અન્ય મળવાપાત્ર કાર્યવાહી માટે આ પ્રકરણને ગુજરાત રાજ્યના ચીફ કમિશ્નર ઓફ ટેક્સ સમક્ષ રજુ કરવા ચેમ્બરે ભારપૂર્વક રજુઆત કરેલ છે. રાજકોટ ચેમ્બરની રજુઆત ધ્યાને લઈ ચીફ કમિશ્નરશ્રીમતી સીમા અરોરા દ્વારા તેનું જલ્દીથી નિરાકરણ લાવી શકાય તેવી ખાત્રી આપેલ હતી તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.